



DD-1901210202010402 Seat No. \_\_\_\_\_

M. A. (Sem. I) Examination

March - 2022

Philosophy (2019)

(Philosophy of Yoga)

Time :  $2\frac{1}{2}$  Hours]

[Total Marks : 70

સૂચના : (1) બધા પ્રશ્નોના ગુણ સરખા છે.  
(2) કોઈ પણ પાંચ પ્રશ્નોના ઉત્તર આપો.

- |    |   |    |
|----|---|----|
| 1  | કલેશના પ્રકારો સમજાવો.  | 14 |
| 2  | યોગમાં પુરુષનો ખ્યાલ સ્પષ્ટ કરો.                                  | 14 |
| 3  | યોગમાં વૃત્તિ અને તેના પ્રકારો ચર્ચો.                             | 14 |
| 4  | યોગમાં ચિત્રભૂમિ (અવસ્થાઓ) સમજાવો.                                | 14 |
| 5  | યોગનો અષ્ટાંગમાર્ગ ચર્ચો.   | 14 |
| 6  | યોગમાં કૈવલ્યનો ખ્યાલ સમજાવો.                                     | 14 |
| 7  | યોગમાં સમાધિનો ખ્યાલ અને પ્રકારો ચર્ચો.                           | 14 |
| 8  | યોગમાં ઈશ્વરનું સ્થાન સ્પષ્ટ કરો.                                 | 14 |
| 9  | ટૂંકનોંધ લખો :<br>(1) ક્રિયાયોગ<br>(2) યોગમાં વૈરાગ્ય             | 14 |
| 10 | ટૂંકનોંધ લખો :<br>(1) યોગની વ્યાખ્યા<br>(2) યોગમાં વિભૂતિનો ખ્યાલ | 14 |

## ENGLISH VERSION

**Instructions :** (1) All questions carry equal marks.  
(2) Answer any five questions.

- |           |   |           |
|-----------|---|-----------|
| <b>1</b>  | Explain the types of Klesh.   | <b>14</b> |
| <b>2</b>  | Clarify the concept of Purush in Yoga.  | <b>14</b> |
| <b>3</b>  | Discuss Vrutti and its types in Yoga.   | <b>14</b> |
| <b>4</b>  | Explain Chitt Bhumi in Yoga.  | <b>14</b> |
| <b>5</b>  | Discuss Yoga's Astang Marg.   | <b>14</b> |
| <b>6</b>  | Explain the concept of Kaivalya in Yoga.  | <b>14</b> |
| <b>7</b>  | Discuss the concept of Samadhi and its types in Yoga.                           | <b>14</b> |
| <b>8</b>  | Clarify the place of God in Yoga.   | <b>14</b> |
| <b>9</b>  | Write short notes :<br>(1) Kriya Yoga<br>(2) Vairagya in Yoga                   | <b>14</b> |
| <b>10</b> | Write short notes :<br>(1) Definition of Yoga<br>(2) Concept of Vibhuti in Yoga | <b>14</b> |
-